

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED

BHATIA'S[®]
The mobile one stop shop

CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Email: info@bhatiamobile.com, Ph: 0261-2349892
Website : www.bhatiamobile.com

Date: 16/02/2022

To,
BSE LIMITED
Phiroze Jeejeebhoy towers,
Dalal Street,
Mumbai- 400 001.

Script Code : BHATIA/540956
Subject : Intimation of Newspaper Advertisement of Extract of standalone unaudited financial results for the Quarter and Nine Months Ended 31st December, 2021
Reference No. : Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Unaudited Financial Result for the Quarter and nine months ended on 31st December, 2021 published in Newspapers on Wednesday, 16th February, 2022

1. English Daily: "Free Press Gujarat" dated 16th February, 2022
2. Regional Language Daily: "Lokmitra" dated 16th February, 2022

You are requested to kindly take the same on record.

Yours Faithfully,
Thanking you

For Bhatia Communications & Retail (India) Limited


Sanjeev Harbanslal Bhatia
Managing Director
(DIN: 02063671)



Place: Surat

Encl: Copy of Newspaper

KLM Axiva Finvest Non-Convertible Debentures is Open

Ahmedabad, The public issue of secured, redeemable, non-convertible debentures of face value of 1,000 each (NCDs) at par, aggregating up to ? 10,000 lakhs with an option to retain over subscription up to ? 10,000 lakhs, aggregating up to ? 20,000 lakhs (the "Issue") by KLM Axiva Finvest Limited ("Company") has opened today. The Company is a non-deposit taking systemically important non-banking finance company ("NBFC") primarily serving low and middle income individuals and businesses that have limited or no access to formal banking and finance channels. The Company offers variety of gold loan schemes to our customers to suit their individual needs. The schemes differ in relation to the amount advanced per

gram of gold, tenure, interest rate chargeable and amount of loan. The Issue has opened for subscription on Tuesday, February 15, 2022, and will close on Friday, March 11, 2022. Vivro Financial Services Private Limited is the lead manager to the Issue and Vistra ITCL (India) Limited is the debenture trustee to the Issue. CAR Ratings Limited has given the ratings to the Issue as "CARE BB+; Positive (Double B Plus; Outlook: Positive)". The annual interest rate for the Issue is ranging from 9.75% to 11.25% and is available in monthly, annually and cumulative options for tenures 366 days, 400 days, 18 months, 2 years, 3 years, 5 years and 80 months, giving the effective yield of upto 11.57% for the longer duration. (19-10)

MG Motor produces & delivers mobility solutions

Ahmedabad, MG Motor has always been vocal about creating a sustainable automotive industry in India. The company has recently acquired ISO certification on Environment Management System (ISO 14001 - 2015) and Occupational Health & Safety Management System (ISO 45001 - 2018). Furthermore, MG is also working towards installing a carbon-neutral & net-zero emission approach in its operations. Apart from the ISO certifications, MG Motor has already implemented a few other sustainable initiatives, including planting more than 7000 trees and adding 12 rainwater recharge wells to improve the groundwater level. MG has also worked on increasing energy productivity through Energy Committee and becoming a zero-waste landfill



site. Furthermore, the MGI plant has been de-notified by State Government from MAH (Major Accident Hazard unit) to the non-MAH unit by eliminating the major hazard and installing 092 MT LPG & 22 MT NG storage tanks on premises. MG Motor's 360-degree approach to sustainability has empowered the company to go above and beyond. The company has been at the forefront of promoting EV adoption, recycling, batteries and launching modern EVs for its customers. (1-7)

IBM celebrates the third anniversary of its STEM for Girls



Mathew Joseph, Country Director, American India Foundation and Aakash Sethi, CEO, Quest Alliance and Dr. Nisha Tendiratta, Advisor & Scientist G, Climate Change Programme, who represented the Department of Science and Technology, Government of India.

In the last three years, IBM has conducted various programs under the initiative to empower over 2,00,000 government schoolgirls and 1,00,000 boys to pursue STEM education. These students hail from various districts across 12 states - Punjab, Haryana, Rajasthan, Gujarat, Karnataka, Andhra Pradesh, Telangana, Odisha, Bihar, Assam, Nagaland, and Uttarakhand. (19-10)

"There is a Dadasaheb Phalke in all of us," says Anand Pandit



And then went on to make 95 features and 27 shorts in just 19 years? He is the reason why we have come this far and he is still the wellspring of inspiration for us all. The maker known for his mythological works like Mohini Bhasmasu, Satyavan Savitri, Lanka Dahari, and Sri Krishna Janma created the cinematic template that was followed by many other makers subsequently and says Pandit, "There is a Dadasaheb Phalke in all of us. All of us want to be celebrated as pioneers, break new ground and create a legacy that will be remembered forever but it is near impossible even today to do one percent of what he did all those decades ago with such limited means." Pandit believes his expertise came from his multifaceted talent and says, "When we make films, it is important to have an artist's eye and technical proficiency and Dadasaheb was an artist and a technical whiz. (19-10)

Ahmedabad, The father of Indian cinema, Dhrundiraj Govind Phalke or Dadasaheb Phalke passed away on 16 February 1944 but even today the influence of this iconic producer, director, and screenwriter on subsequent generations, remains unsurpassed. Veteran producer Anand Pandit has great admiration for the pioneer and says, "Can you imagine that Dadasaheb made India's first full-length feature film back in 1913 without a single precedent?

WR COLLECTS Rs 80 CRORE AS FINE DURING INTENSIVE TICKET CHECKING DRIVE FROM APRIL 2021 TO JANUARY 2022

Ahmedabad, Western Railway has been conducting regular ticket checking drives with a check on unauthorized traveling. Through these intensive drives, WR recovered Rs. 80.07 crore for irregular travel while Rs 26.92 lakh were received as fine from without mask cases, during the period April 2021 to January 2022. According to a press release issued by Shri Sumit Thakur - Chief Public Relations Officer of Western Railway, during the checks conducted from April 2021 to January 2022, about 13.67 lakh cases of ticketless/irregular travel including unbooked luggage cases were detected, resulting in a recovery of Rs. 80.07 crore. During the period, 9 cases of transfer of reserved tickets were detected and over Rs. 13,000/- were realized. Besides this, 540 beggars & 613 unauthorized hawkers were apprehended, out of which, 242 were charged and an amount of Rs. 1,04,165/- was realized as Railway dues. 369 persons were prosecuted & Rs. 1,34,870/- were recovered in fine. Ticket Checking staff have been vested with the power to collect fines from passengers without masks. As a result, 14,492 cases of traveling without masks were realized. Besides this, an amount of approx. Rs 26.92 lakh was recovered from 17th April, 2021 to 31st January, 2022 over Western Railway.

DISHA RESOURCES LIMITED
REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H, AJANTA COMM. ESTATE, ASHRAM ROAD, AHMEDABAD-380014
PHONE: (OFF). 2754-0790, 27543060 E-MAIL: info@aacil.in
CIN: L74110GJ1995PLC024869 Website: www.aacil.co.in

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED ON 31ST DECEMBER, 2021 (In Lakhs except EPS)

PARTICULARS	Quarter ended on 31.12.2021 (unaudited)	Nine months ended on 31.12.2021 (unaudited)	Corresponding 3 months ended in the previous year 31.12.2020 (unaudited)
Total Income from Operations	13.56	153.40	2.71
Net profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(6.25)	(4.18)	43.86
Net profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(6.25)	(4.18)	43.86
Net profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(6.25)	(4.18)	43.86
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive Income (after tax))	888.57	1305.00	352.73
Paid-up equity Share Capital	731.55	731.55	731.55
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)			
Basic	12.15	17.84	4.82
Diluted	12.15	17.84	4.82

Notes:
1. The above is an extract of the detailed format of the quarter and nine months ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the stock Exchange website - www.bseindia.com & on company's website - www.aacil.co.in
2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th February, 2022.
3. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the quarter ended on 31st December, 2021 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

FOR, DISHA RESOURCES LIMITED
KRISHNA AWATAR KARRA
MANAGING DIRECTOR
DIN: 00650817

SHUBHAM POLYSPIN LIMITED
(CIN: L17120GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jetपुरa - Basantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankit@shubhamgrp.co Website: www.shubhampolyspin.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2021 (Rs. In Lakhs)

Particulars	Quarter ended on 31-12-2021 (Unaudited)	Cumulative upto 31-12-2021 (Unaudited)	Quarter ended on 31-12-2020 (Unaudited)
Total income from operations	1303.26	4179.88	1090.20
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	41.69	114.34	16.78
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items #)	41.69	114.34	16.78
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items #)	35.16	83.23	7.68
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	35.16	83.23	7.68
Equity Share Capital	1102	1102	1102
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	0.32	0.76	0.07

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.
2. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and on the website of the Company, (www.parkergrochem.com).
3. # - Exceptional and/or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

FOR, SHUBHAM POLYSPIN LIMITED
ANKIT ANIL SOMANI
MANAGING DIRECTOR (DIN: 05211800)

SIKKO INDUSTRIES LIMITED
(CIN: L51909GJ2000PLC037329)
Regd. Office: 508,ISON Elegance, Nr. Jain Temple, Nr. Prahladnagar Pick up Stand, Vejalpur, Ahmedabad - 380 051.
Phone: +91 79- 66168950/66168951; E-mail: compliance@sikkoindia.com; Website: www.sikkoindia.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2021 (Rs. In Lakh except EPS)

Particulars	Quarter ended on 31/12/2021		Quarter ended on 31/12/2020
	Unaudited	Unaudited	Unaudited
Total Income from Operations	1200.99	3669.80	879.26
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	106.83	362.26	38.40
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	106.83	362.26	38.40
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	76.61	260.92	27.38
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	76.61	260.92	27.38
Equity Share Capital	1120.00	1120.00	560.00
Reserves (excluding Revaluation Reserve as per the audited Balance Sheet of the previous year)	-	-	-
Earnings Per Share (for continuing and discontinued operations)-			
Basic: (not annualized for the quarter ended)	0.68	2.33	0.47
Diluted: (not annualized for the quarter ended)	0.68	2.33	0.47

Note - The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the NSE under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly financial Results are available on the Website of NSE at www.nseindia.com and Company's website at www.sikkoindia.com.

For, Sikko Industries Limited
Jayantibhai Kumbhani
Managing Director(DIN: 00587807)



SYMBOLIC POSSESSION NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 (Plot No- B3, WIPIT Park, Wagje Industrial Estate, Thane, Maharashtra-400604)
Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) R/W Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, (on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security in respect of a housing loan facility granted pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.
As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/hir under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sl. No.	Name of the Borrower/ Number of Symbiotic Possession (DHFL Old LAN & ICICI New LAN)	Description of Property/ Date of Symbiotic Possession	Date of Demand Notice/ Amount in Demand (Rs.)	Name of Branch
1.	Bhavesh Mahendra Upadhyay & Chhayaben Bhavesh Upadhyay-QZVSI0005031283 (DHFL Old LAN-11000003421 & ICICI New LAN-QZVSI0005031283)	Flat No. 301, Maruti Heritage Opp Vijay Park Bus Stand BH Prakash Hindi High School Sajpur Bogha Ahmedabad-380024, February 10, 2022	March 25, 2021 Rs. 8,51,144.00/-	Vasali

The above-mentioned borrowers(s) guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.
Date: February 16, 2022
Authorized Officer
ICICI Bank Limited



ZEAL AQA LIMITED
CIN: U0504GJ2009PLC056270
Registered Office: ICICI Bldg, Plot No. 4, 5, 1a Oldpat, Surat 395450, Gujarat
Tel.: +02621-220047; Website: www.zealqa.com Email Id: zealqa@gmail.com

Extract of Unaudited Financial Result for the Quarter and Nine months ended 31st December, 2021 Amount in Lakh except EPS

Sl. No.	Particulars	Quarter ended 31st December 2021 (Unaudited)	Nine Months Ended 31st December 2021 (Unaudited)	Quarter ended 31st December 2020 (Unaudited)
1	Total Income from Operations	11818.288	24962.773	13112.757
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	161.389	573.555	128.136
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	161.389	573.555	128.136
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	111.389	523.555	128.136
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax))	111.389	523.555	128.136
6	Paid-up Equity Share Capital (face value of Re. 1/- each)	1260.660	1260.660	1260.660
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year*	-	-	-
8	Earnings Per Share (face value of Re. 1/- each) (for continuing and discontinued operations)			
1. Basic	0.09	0.42	0.10	
2. Diluted	0.09	0.42	0.10	

* Reserves for the year ended March 31, 2021 was Rs. 4545.806 lakhs
Note:
1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.zealqa.com.
2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 14th February, 2022.
3. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.
For Zeal Aqa Limited
Shantilal Patel
Sd
(Chairman and Managing Director)
DIN: 01362109

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED
(CIN: L32109GJ2008PLC053336)
Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395900
Website: www.bhatiamobile.com, Mail: info@bhatiamobile.com, Ph: 0261-2349892

Extract of Unaudited Financial Result for the Quarter and Nine months ended 31st December, 2021

Sl. No.	Particulars	Quarter ended 31st December 2021	Nine Months Ended 31st December 2021	Quarter ended 31st December 2020
1	Total Income from Operations	6570.478	17447.688	5548.894
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	277.742	515.726	152.474
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	277.742	515.726	152.474
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	171.133	349.559	96.378
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax))	171.133	349.559	96.378
6	Equity Share Capital (face value of Rs. 10/- each)	1251.520	1251.520	1251.520
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year*	-	-	-
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
1. Basic	1.367	2.793	0.770	
2. Diluted	1.367	2.793	0.770	

* Reserves for the year ended March 31, 2021 was Rs. 2856.312 lakhs.
Note:
1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com.
2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 14th February, 2022.
3. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.
For Bhatia Communications & Retail (India) Limited
Sanjeev Harbanslal Bhatia
Sd/-
Managing Director
DIN: 02063671